


સુરત જિલ્લો



- ❖ સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે.
- ❖ સુરત જિલ્લાની આજુબાજુ ભરૂચ, નવસારી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાની સરહદો આવેલી છે.
- ❖ ક્ષેત્રફળ : ૪,૪૧૮ ચો.કિમી
- ❖ સ્થાપના :- ૧૯૬૦
- ❖ વિધાનસભાની કુલ સીટો :- ૧૮ { ઓલપાડ, માંગરોલ (એસ.ટી), માંડવી(એસ.ટી), કામરેજ, સુરત-ઈસ્ટ, સુરત-નોર્થ, વરાછારોડ, કારંજ, લિંબાયત, ઉધના, મુંજરા, કતારગામ, સુરત-વેસ્ટ, ચોર્યાસી, બારડોલી(એસ.સી) અને મહુવા }
- ❖ વસ્તી :- ૬૦,૭૯,૨૩૧ (૨૦૧૧)
- ❖ વસ્તી ગીચતા :- ૧૩૩૭
- ❖ અક્ષર જ્ઞાન :- ૮૫.૫૩%
- ❖ સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૭૮૭(દર હજારે)
- ❖ મુખ્ય મથક :- સુરત

- ❖ તાલુકાઓ:- ૧૦ (૧)બારડોલી, (૨)કામરેજ, (૩) બારડોલી (૪)મહુવા, (૫) ઓલપાડ, (૬) માંડવી (૭)પલસાણા, (૮)માંગરોળ, (૯)ઉમરવાડા અને (૧૦)ચૌર્યાસી
- ❖ તાલુકા પંચાયતની કુલ સીટો :- ૧૦ (બેઠકો-૧૯૬)(ભાજપ-૧૨૭, કોંગ્રેસ-૬૩ અન્ય-૬) (માંડવી-૨૪, ચૌર્યાસી -૨૨, માંગરોળ-૨૪, બારડોલી- ૨૨,ઓલપાડ-૨૪, મહુવા-૨૦,પલસાણા-૨૦, કામરેજ-૨૪ અને ઉમરવાડા-૧૬)
- ❖ જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૪૦ (ભાજપ-૨૭, કોંગ્રેસ-૧૨ અન્ય-૦૧)
- ❖ જિલ્લા પંચાયત પ્રમુખ :- સુરેશભાઈ પટેલ
- ❖ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- લલીતાબેન પટેલ
- ❖ નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ:- ૩ (બારડોલી-૯(૩૬)(ભાજપ-૨૫, કોંગ્રેસ-૧૧ અન્ય-૦),કડોદરા- ૭ (૨૮)(ભાજપ-૨૧, કોંગ્રેસ-૦૭ અન્ય-૦)અને સચિન-૭ (૨૮)(ભાજપ-૨૬, કોંગ્રેસ-૦૨ અન્ય-૦))
- ❖ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ વોર્ડ અને સીટો :- ૨૯ (બેઠકો- ૧૧૬)(ભાજપ-૮૦, કોંગ્રેસ-૩૬ અન્ય-૦)
- ❖ સુરતના મેયર :-
- ❖ સુરતના ડેપ્યુટી મેયર:-
- ❖ ગામડાંઓ :-૧૨૮૦
- ❖ પાક:- ઘઉં,જુવાર,શેરડી,તુવેર,કપાસ,ડાંગર,કઠોળઅનેફળો
- ❖ ઉદ્યોગ:-હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ,ટેક્સટાઈલ ઉદ્યોગ,ખાંડ અને કાગળ ઉદ્યોગ,પાવર ઉદ્યોગ અને રાસાયણિક ખાતર ઉદ્યોગ
- ❖ ખનીજ:- ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઈટ, લાઈમ સ્ટોન
- ❖ નદીઓ:- તાપી,કીમ અને મીઠોલી
- ❖ તળાવ :- ગોપી તળાવ (સુરત)
- ❖ વાવ :- સોઢાળી વાવ (માંગરોળ)
- ❖ કુંડ :- કતાર કુંડ (કતાર)
- ❖ જળાશય (ડેમ):- કાકરાપાર ડેમ
- ❖ પર્વતો:-
- ❖ બંદરો :- મગદલ્લા ,સુરત,હજીરા,ડુમ્મસ
- ❖ આરટીઓ :- GJ-05 , GJ-28
- ❖ અગત્યના સ્થળો :- બારડોલી ,ડુમ્મસ ,હજીરા ઉકાઈ ઉતરાણ ,ઉધાન
- ❖ જોવાલાયક સ્થળો : - સુરત હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ , ડુમ્મસ પ્રવાસધામ માટે ભારતભરમાં જાણીતું છે, હજીરા વિહારધામ .

વિશેષ નોંધ :

- ❖ અંગ્રેજ સરકારની પહેલી વેપારી કોઠી ની સ્થાપના સુરતમાં કરવામાં આવી હતી.

- ❖ સુરત તાપી કિનારે વસેલું શહેર છે. સુરત હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને જરી ઉદ્યોગ માટે ભારતભરમાં પ્રખ્યાત છે.
- ❖ સુરત ગુજરાતનું અગ્રગણ્ય વેપારી મથક અને ઔદ્યોગિક શહેર છે તણસાઈનું કાપડ શહેરની વિશિષ્ટતા છે.
- ❖ ઉધનામાં રેયોન, જરી,અરીસા,ઘડિયાળ અને મશીન ટૂલ્સ ઉદ્યોગ વિકસ્યા છે.
- ❖ એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ સુરતમાં આવેલી છે.
- ❖ સુરત જીલ્લામાં દુબળા આદિવાસીઓનું હાલી નૃત્ય જાણીતું છે.
- ❖ સુરતમાં સૌપ્રથમ પ્લેટોરિયમની સ્થાપના થઈ હતી.
- ❖ સુરત 'મક્કાનું પ્રવેશદ્વાર' તરીકે ઓળખાય છે. આ ઉપરાંત 'બંદર -એ- મુબારક' તરીકે સુરત ઓળખાય છે.
- ❖ સુરત જિલ્લામાં સૌથી વધુ સિંચાઈ નહેરો દ્વારા થાય છે.